

04 ફેબ્રુઆરી 2019

બ્રેમ્પટનમાં બ્લેક હિસ્ટરી મન્થની ઉજવણી

બ્રેમ્પટન, ઓન્ટારિયો – સીટી ઓફ બ્રેમ્પટને ફેબ્રુઆરી 1ના રોજ સીટી હોલ ખાતે ભાષણો, કવિતાઓ અને ફેબ્રુઆરીને બ્લેક હિસ્ટરી મન્થ તરીકે જાહેર કરતી ઘોષણાના પઠન સાથે બ્લેક હિસ્ટરી મન્થની ઉજવણીનો સત્તાવાર પ્રારંભ કર્યો.

બ્રેમ્પટનનાં અશ્વેત આફ્રિકન અને કેરિબિયન સમુદાયોનાં સન્માનમાં સીટી ફેબ્રુઆરીમાં બે વધુ ઈવેન્ટ્સ યોજા રહ્યા છે.

બ્લેક હિસ્ટરી મન્થનાં આકર્ષણો

બ્રેમ્પટન સીટી હોલ ખાતે ફેબ્રુઆરી 22ને શુક્રવારના રોજ બપોરના ભોજન માટે બપોરે 12 થી 2 વાગ્યા સુધી પધારો! કન્ઝર્વેટરીમાં સ્થાનિક વિક્રેતાઓ \$5 અથવા ઓછી કિંમતે વિજ્જતદાર નાસ્તા અને ભોજનની વસ્તુઓ વેચશે.

સમાપનનો ઈવેન્ટ

બ્લેક હિસ્ટરી મન્થના સમાપનની ઉજવણી સીટીના ક્લોઝિંગ ઈવેન્ટમાં ગુરુવાર, ફેબ્રુઆરી 28ના રોજ જોરદાર ઢબે કરો. સાંજે 4:30 થી 8:00 વાગ્યે બ્રેમ્પટન સીટી હોલ નૃત્ય, સંગીત, વ્યાખ્યાનો, ફેસ પેઈન્ટિંગ સહિતની બાળકો માટેની પ્રવૃત્તિઓ અને વિક્રેતાઓની ડાજરીથી થનગની ઉદશે. સાંજે 6 વાગ્યે મંચ ઉપર રજૂઆતો શરૂ થઈ જશે અને અલ્પાહાર ઉપલબ્ધ થશે.

"સીટી ઓફ બ્રેમ્પટન સહુ પ્રથમ વખત સાર્વજનિક બ્લેક હિસ્ટરી મન્થનું યજમાન બની રહ્યું છે તેનો મને ગર્વ છે. આખી કાઉન્સિલ વતી અમે અશ્વેત આફ્રિકન અને કેરિબિયન સમુદાયોનું સન્માન, અને ભવિષ્યમાં અનેક સાંસ્કૃતિક ઈવેન્ટ્સ કરવાની તક મેળવવા આતુર છીએ." એવું મેયર પેટ્રિક બ્રાઉને (Mayor Patrick Brown) જણાવ્યું હતું.

બ્લેક હિસ્ટરી મન્થ એક રાષ્ટ્રીય ઉત્સવ છે જે અશ્વેત કેનેડિયનોએ કેનેડાની વિરાસત અને ઓળખ માટે આપેલ મહત્વપૂર્ણ ડ્રાળાને બિરદાવે છે. બ્રેમ્પટનના ઈવેન્ટ્સ આપણા શહેરી જીવનનાં તમામ પાસાઓ માટે આપણા અશ્વેત સમાજે ભૂતકાળ અને વર્તમાનમાં આપેલ ડ્રાળાને બિરદાવે છે.

બ્લેક હિસ્ટરી મન્થમાં થનાર બ્રેમ્પટન ખાતેના ઈવેન્ટ્સ વિશેની વધુ વિગતો માટે [અહીં ક્લિક કરો](#).

-30

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફેકસ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સુપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર અનુસરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

मिडिया संपर्क:

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी अंगेजमेन्ट

व्यूडात्मक संवाद

सीटी ओफ् ब्राम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca